

પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનું ઉદ્ઘાટન, કૃષિ મેળો તેમજ પુર્વ રવી અભિયાન કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આકૃયુ, મુવાલીયા ફાર્મ, દાહોદ ખાતે યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલીયા ફાર્મ, દાહોદ ખાતે "પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ" કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રી નરેન્દ્રભાઈ મોદી, માનનીય પ્રધાનમંત્રીશ્રી, ભારત સરકાર, દ્વારા ગોરખપુર (ઉત્તર પ્રદેશ)થી કરેલ જેનું જીવંત પ્રસારણ તેમજ "કૃષિ મેળો" અને "પુર્વ રવી અભિયાન" કાર્યક્રમ તારીખ ૨૪.૦૨.૨૦૧૯ના રોજ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, મુવાલીયા ફાર્મ, આકૃયુ, દાહોદ ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક, શ્રી જસવંતસિંહજી ભાભોર, માન. મંત્રીશ્રી, આદિજાતી વિકાસ, ભારત સરકાર, અધ્યક્ષ, શ્રી બચુભાઈ ખાબડ, માન. મંત્રીશ્રી, ગ્રામિણ આવાસ અને પશુપાલન ખાતુ (રા.ક.), ગુજરાત સરકાર, શ્રી વિજયકુમાર ખરાડી (IAS), માન. જીલ્લા કલેક્ટર, દાહોદ, શ્રી આર. કે. પટેલ (IAS), માન. જીલ્લા વિકાસ અધિકારી, દાહોદ, શ્રી તેજસકુમાર પરમાર (IAS), માન. પ્રાંત અધિકારી, દાહોદ, ડૉ. કે.બી. કથીરીયા, માન. સંશોધન નિયામકશ્રી, આકૃયુ, આણંદ, શ્રી જે. એચ. સુથાર, જીલ્લા ખેતીવાડી અધિકારી, દાહોદ, ડૉ. શશીધરન, સંશોધન વૈજ્ઞાનિક, હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, આકૃયુ, દાહોદ, ડૉ. એમ. એમ. ત્રિવેદી, આચાર્યશ્રી, કૃષિ ઇજનેરી પોલીટેકનિક, દાહોદ, ડૉ. જી. જે. પટેલ, યુનિટ વડાશ્રી, મહિલા આદિવાસી તાલીમ કેન્દ્ર, આકૃયુ, દેવગઢ બારીઆ, ડૉ. કે. એલ. ગોસાઈ, નાયબ પશુપાલન નિયામકશ્રી, દાહોદ, શ્રી બલાત સાહેબ, નિયામકશ્રી, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દાહોદ, શ્રી નિનામા સાહેબ, જીલ્લા લીડ બેંક મેનેજરશ્રી, દાહોદ, શ્રી અમિતકુમાર પરમાર, મામલતદારશ્રી, દાહોદ, શ્રીમતિ રેણુકાબેન સી. ગણાવા, તાલુકા વિકાસ અધિકારીશ્રી, દાહોદ તેમજ કાર્યક્રમના આયોજક ડૉ. યુ એમ. પટેલ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દાહોદના વૈજ્ઞાનિકશ્રીઓ તેમજ મુવાલીયા ફાર્મ હસ્તકના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહેલ હતા.

શ્રી જસવંતસિંહજી ભાભોર, માન. મંત્રીશ્રી, આદિજાતી વિકાસ, ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાનો લાભ લેવા અને વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી થાય તે હેતુસર આધુનિક ખેતી તેમજ નવી તાંત્રિકતા અપનાવવા અપીલ કરી હતી. શ્રી બચુભાઈ ખાબડ સાહેબ, માન. મંત્રીશ્રી, ગ્રામિણ આવાસ અને પશુપાલન ખાતુ (રા.ક.), ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓનો લાભ લઈ દાહોદ જીલ્લામાં ખેત ઉત્પાદન વધે તેમજ વૈજ્ઞાનિક અભિગમથી પશુપાલન કરવા માટે ખેડૂતોને ઉદ્બોધન આપ્યું હતું તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા ખેતી, બાગાયત અને પશુપાલન વિષયો પર ખેડૂતોને માહિતગાર કર્યા હતા.

આ કાર્યક્રમમાં માન. પ્રધાનમંત્રીશ્રી, ભારત સરકાર દ્વારા "મન કી બાત" અને "પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ" યોજનાનો ઉદ્ઘાટન ગોરખપુર, ઉત્તર પ્રદેશથી કરવામાં આવેલ. જેનું જીવંત પ્રસારણ સદર કાર્યક્રમમાં આવેલ કુલ ૨૦૭૮ જેમાં ૧૬૫૫ ખેડૂતભાઈઓ અને ૪૨૩ ખેડૂતબહેનોએ તેમજ પધારેલ મહાનુભાવો અને પદ્ધાધિકારીશ્રીઓ દ્વારા નિહાળવામાં આવેલ.

આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આકૃયુ, દાહોદ, હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, આકૃયુ, દાહોદ, કૃષિ ઇજનેરી પોલીટેકનિક, આકૃયુ, દાહોદ, આદિવાસી મહિલા તાલીમ કેન્દ્ર, આકૃયુ, દેવગઢ બારીઆ, મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર, આકૃયુ, ગોધરા, કૃષિ ઇજનેરી અને તકનિકી મહાવિદ્યાલય, આકૃયુ, ગોધરા, ખેતીવાડી ખાતુ, દાહોદ, બાગાયત ખાતુ, દાહોદ, પશુપાલન ખાતુ, દાહોદ, આત્મા પ્રોજેક્ટ, દાહોદ, સદગુરુ ફાઉન્ડેશન, દાહોદ, ઉત્થાન સંસ્થા, લીમખેડા, ગ્રામિણ વિકાસ ટ્રસ્ટ, દાહોદ, જી.એસ.એફ.સી., દાહોદ અને લીડ બેંક, દાહોદ એમ કુલ ૧૫ સ્ટોલ ગોઠવવામાં આવેલ હતા જેની મહાનુભાવો તેમજ ખેડૂતો દ્વારા મુલાકાત લઈ માર્ગદર્શન મેળવેલ હતુ.

આ કાર્યક્રમમાં કેન્દ્રના વૈજ્ઞાનિકો, કૃષિ ઇજનેરી પોલીટેકનિકના પ્રાધ્યાપકો, રીસર્ચ એસોસિએટશ્રીઓ અને હલકા ધાન્ય સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રીઓ તેમજ મુવાલીયા કેમ્પસના કર્મચારીશ્રીના અથાગ પરીશ્રમના અંતે સફલતાપુર્વક પુર્ણ કરવામા આવ્યો હતો.



શ્રી જસવંતસિંહજી ભાભોર સાહેબનુ ઉદ્બોધન



શ્રી બચુભાઈ ખાબડ સાહેબનુ ઉદ્બોધન



માન. પ્રધાનમંત્રીશ્રી દ્વારા "મન કી બાત" નુ જીવંત પ્રસારણ



"પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ" યોજનાનો ઉદ્ઘાટનનુ જીવંત પ્રસારણ



મહાનુભાવો દ્વારા જુદા જુદા પ્રદર્શન સ્ટોલોની મુલાકાત



ડૉ. યુ. એમ. પટેલનુ ઉદ્ઘોષન



કાર્યક્રમમાં ભાગ લીધેલ ખેડુતો